

ડિસેમ્બર 18, 2018

બ્લુ-પો પ્રોગ્રામથી લાયસન્સધારક પ્રાણી માલિકોને બ્રામ્પટનમાં નાણાં બચાવવાની છૂટ મળી

બ્રામ્પટન, ઓન્ટેરિયો – જો તમે બ્રામ્પટનમાં કોઈ પાળેલા પ્રાણીના માલિક હો તો, તમારા કૂતરા કે બિલાડીનું લાયસન્સ મેળવવું એક બહુ સારું કારણ બની શકે છે – બહુ સહેલાઈથી, તે તમારા પાળેલા પ્રાણીને સુરક્ષિતપણે ઘરે લાવવાની શ્રેષ્ઠ રીત છે જો આ પ્રાણી ગુમ થાય. હવે, તમારા પાળેલા પ્રાણીનું લાયસન્સ તમારા નાણાં બચાવી શકે છે જ્યારે પણ તમે ખરીદી કરો.

બ્રામ્પટન એનિમલ સર્વિસીસે આજે બ્લુ-પો પ્રોગ્રામ શરૂ કર્યો, એક રિવોર્સ કાર્યક્રમ જે લાયસન્સધારક પાળેલા પ્રાણીના માલિકોને સ્થાનિક ધંધાઓ સાથે સહભાગી થવાથી ખાસ સોદો કરાવી આપે છે. જ્યારે કોઈ રહેવાસી પોતાના કૂતરા કે બિલાડીનું સીટી ઓફ બ્રામ્પટન પાસેથી લાયસન્સ મેળવે ત્યારે, તેઓ સ્વચાલિત રીતે આ કાર્યક્રમમાં પ્રવેશે છે અને તેઓ એક ખાસ ફી ટેંગ મેળવશે. જ્યારે સહભાગી ધંધા પાસેથી ખરીદી કરો ત્યારે, સભ્યો બચતનો આનંદ માણે તે પહેલાં તેઓએ સરળતાથી પોતાનો ટેંગ દેખાડવાની જરૂર છે.

બ્લુ-પો પ્રોગ્રામની પહેલી વખત શરૂઆત સીટી ઓફ ટોરોન્ટો દ્વારા વર્ષ 2014 માં કરવામાં આવી હતી, અને બ્રામ્પટન આ કાર્યક્રમનું પહેલું ભાગીદાર શહેર છે. બ્રામ્પટન રહેવાસીઓ ટોરોન્ટોના ધંધાકીય સભ્યો પાસેથી ઓફર્સ મેળવવાને પાત્ર પણ છે, જેઓની યાદી અહીં ઉપલબ્ધ છે www.toronto.ca/bluepaw.

લાયસન્સ ફી વાર્ષિક ધોરણે \$5 થી \$40 જેટલી હોય છે, જે પ્રાણીના પ્રકાર (કૂતરા કે બિલાડી) અને શું માદાનું અંડાશય કાઢેલું છે/નરનું વૃષણ કાઢી નાખેલું છે અને માઈક્રોચિપ લગાવેલી છે કે કેમ તેને આધારિત હોય છે. 55 વર્ષ અને વધારે ઉંમરના માલિકો (વડીલો) માટે સીનિયર દરો પણ છે. લાયસન્સ ફીમાંથી એકઠા થયેલા નાણાં દરરોજ આશ્રય સ્થાન માટે આવતા પ્રાણીઓ માટે એનિમલ સર્વિસીસ કરને મદદરૂપ થાય છે.

લાયસન્સ મેળવવું અને બ્લુ-પો પ્રોગ્રામ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/animalservices.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રામ્પટનમાં તમામ કૂતરાઓ અને બિલાડીઓ માટે આ શહેર સાથે લાયસન્સ મેળવવું અનિવાર્ય છે, પરંતુ ખરેખર માત્ર એક નજીવી ટકાવારી લાયસન્સ ધરાવે છે. એનિમલ સર્વિસીસને સ્થાનિક ધંધાઓ સાથે ભાગીદારી કરતી જોવામાં મને ખુશી છે જે બ્રામ્પટનના પાળેલા પ્રાણીઓના માલિકો માટે પણ વધારે મૂલ્યવાન છે. મને આશા છે કે આ કાર્યક્રમ વધારે લોકોને તેઓના ડૉગ/કેટ માટે સીનિયર દરો મેળવવા અને તેઓની સુરક્ષાની ખાતરી કરાવવામાં મદદ મેળવવા પ્રોત્સાહિત કરશે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“તમે કદાચ વિચારો કે તમારો કૂતરો તમારી બાજુ છોડી દેવા બહુ સારી રીતે તાલીમબદ્ધ છે, અથવા એ કે તમારી બિલાડી તમારા ધ્યાનમાં આવ્યા વગર ક્યારેય બહાર લપસશે નહીં. પરંતુ દર વર્ષે, બ્રામ્પટન એનિમલ સર્વિસીસને ગુમાવેલા પાળેલા પ્રાણીઓ માટે સેંકડો ફોન કોલ્સ મળે છે. તક કેમ લેવી? લાયસન્સ કરાવેલું પાળેલું પ્રાણી એક સુરક્ષિત પ્રાણી છે, અને બ્લુ-પો પ્રોગ્રામ જવાબદાર પસંદગી કરતા પાળેલા પ્રાણીના માલિકોનો આભાર માનવાની અમારી રીત છે.”

- અમાન્ડા બારેટ્ટ (Amanda Barrett), સુપરવાઈઝર, એનિમલ સર્વિસીસ

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેક્ટના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સક્ષમતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મેનિકા ડુગ્ગલ (Monika Duggal)

વેબસાઇટનેટર, મીડિયા ઍન્ડ વમિઉનિટી ઍનગેજમેન્ટ

સ્ટ્રેટજિક વમિઉનિકેશન

સિટી ઑફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca